

B.Sc. Sem-5 Examination

CC 304

Geology

Time : 2-00 Hours]

August 2021

[Max. Marks : 50]

પ્રશ્ન નંબર 1 to 8 માંથી કોઈ પણ ત્રણના જવાબ આપો.

- | |
|--|
| Q-1. ભારતની મુખ્ય રચના અને તેના સમકક્ષ વિશ્વની રચના સાથે સહસબંધ સમજાવો. 14 |
| Q-2. ભૂસંચલનજન્ય ઘટનાઓ અને સમખ્યક પ્રદેશો સમજાવો. 14 |
| Q-3. પ્રમાણભૂત સ્તરવિધાત્મક યુગોનું વર્ણિન કરો. 14 |
| Q-4. પ્રિકેમ્બીયન યુગના પ્રાચીન ભૌગોલિક સંજોગો; હવામાન અને સજ્જવ સ્વરૂપોનું વર્ણિન કરો. 14 |
| Q-5. બિજાવર શ્રેણી, ગવાલિયર શ્રેણી અને લોહ ધાતુમનિજ શ્રેણી પર નોંધ લખો. 14 |
| Q-6. નિમ્ન ગોડવાના રચના પર નોંધ લખો. 14 |
| Q-7. કરણની જુરાસીક રચના પર ચર્ચા કરો. 14 |
| Q-8. આર્થિક અગત્યતા સાથે ગુજરાતની પ્રિકેમ્બીયન રચના પર ચર્ચા કરો. 14 |
| Q-9. નીચેના માંથી કોઈ પણ ચાર ના જવાબ આપો. 08 |
| i. પથદર્શક જીવાવશેષ અને ખડક જૂથોની વ્યાખ્યા આપો. |
| ii. સ્તરવિધામાં પ્રાચીન ભૌગોલિક સંજોગો કેવી રીત ઉપયોગી છે? |
| iii. દ્વાયાસીક રચનાનું વર્ગીકરણ આપો. |
| iv. ખોડલાઈટ એટલે શું? |
| v. સોસર શ્રેણીનું સ્તરવિધાત્મક સ્થાનનો ઉલ્લેખ કરો. |
| vi. ક્રીડયુરાઈટનું બંધારણ આપો. |
| vii. દામુદા શ્રેણીમાં મળતા બે ફલોરાના નામ આપો. |
| viii. અરવલ્લી રચનાનું વર્ગીકરણ આપો. |

PTO

2/22

E 279-2

B. Sc. Sem - 5 Geology Paper 304

Answer any three questions from the questions number 1 to 8.

- | | |
|--|-----------|
| Q-1. Explain correlation of the major Indian formations with their world equivalents. | 14 |
| Q-2. Explain petrographic provinces and tectonic phenomena. | 14 |
| Q-3. Describe standard stratigraphic eras. | 14 |
| Q-4. Describe paleogeography, climate and life forms of the Pre-Cambrian era. | 14 |
| Q-5. Write note on Bijawar series, Gwalior series and Iron ore series. | 14 |
| Q-6. Write note on Lower Vindyan System. | 14 |
| Q-7. Discuss Jurassics of Kachchh. | 14 |
| Q-8. Discuss Pre-Cambrian of Gujarat with its economic significance. | 14 |
|
Q-9. Answer any four of the following questions. | 08 |
| i. Define zone fossils and rock suites. | |
| ii. How palaeogeography is useful in stratigraphy? | |
| iii. Give the classification of Triassic system. | |
| iv. What is Khondalite? | |
| v. State the stratigraphic position of Saucer series. | |
| vi. State the composition of Kodurite. | |
| vii. Name two flora found in Damuda series. | |
| viii. Give the classification of the Aravalli system. | |